

Seat No. : \_\_\_\_\_

**N17-127**

November-2014

B.Sc., Sem.-V (CBCS)

**305-Elective : Chemistry (Soil)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 70]**

**Instructions :**

- (1) Figures on the right side shows full marks of the questions.
- (2) Show correct number of questions in the answer book.

1. Answer the following questions :

(A) Explain the soil profile.

**OR**

Discuss the different types of soil in detail.

(B) Explain the plant's macro & micro nutrients.

**OR**

What is soil ? Give the importance of soil.

2. Answer the following questions :

14

(A) Explain soil reaction. How to determine pH of soil ?

**OR**

Write short note on soil fertility & productivity.

(B) Discuss the determination of the amount of potassium in soil.

**OR**

Explain how total Nitrogen in soil can be measured.

3. Answer the following questions :

14

(A) Explain the determination of total magnesium in soil by Versenate (EDTA) method.

**OR**

Explain the determination of lime in soil.

(B) Explain 'Soil Structure' for the mechanical analysis of soil.

**OR**

How do you determine the total sulphur present in soil ?

4. Answer the following questions :

14

(A) Discuss the determination of soluble salt in soil.

OR

Discuss the determination of iron (II & III) in soil by atomic absorption spectrometric method.

(B) How the silica in agriculture soil can be measured ?

OR

Explain the determination method of total Mn (Manganese) in soil.

5. Answer the following questions in short :

14

- (1) Write the general and chemical composition of soil.
- (2) Name the Micronutrients present in soil.
- (3) Give the name of factors which are responsible for formation of soil.
- (4) Write name of the available macronutrients in soil.
- (5) What is the basis of flame photometry ?
- (6) Which solution are used in determination of 'available phosphorus' in soil ?
- (7) What is pH of productive soil ?
- (8) In which form sulphur present in soil ?
- (9) What are secondary nutrients ?
- (10) Give the name of methods by which calcium and magnesium present in soil are determined.
- (11) Define soluble salt.
- (12) What do you understand by electrical conductivity ?
- (13) What is the conductivity of 0.01N KCl solution at 25 °C temperature ?
- (14) Give the name of method which are used to determination of 'Na' in soil.

**N17-127**

November-2014

**B.Sc., Sem.-V (CBCS)****305-Elective : Chemistry (Soil)****Time : 3 Hours]****[Max. Marks : 70**

- સૂચના :** (1) જમણી બાજુના અંક દરેક પ્રશ્નના ગુણ દર્શાવે છે.  
 (2) ઉત્તરવહીમાં પ્રશ્નનો સાચો કમ દર્શાવો.

1. નીચે દર્શાવેલ પ્રશ્નોના જવાબ આપો :

- (અ) જમીનની રૂપરેખા સમજાવો.

**અથવા**

જમીનના જુદા-જુદા પ્રકાર જણાવી, વિસ્તૃત ચર્ચા કરો.

- (બ) છોડમાં રહેલા મુખ્ય (મેકો) તત્ત્વો અને સૂક્ષ્મ (માઈકો) તત્ત્વોનું વર્ણન કરો.

**અથવા**

જમીન એટલે શું ? જમીનનું મહત્વ જણાવો.

2. નીચે દર્શાવેલ પ્રશ્નોના જવાબ આપો :

- (અ) જમીનની પ્રક્રિયા સમજાવો અને જમીનની pH માપવાની પદ્ધતિ વર્ણાવો.

**અથવા**

જમીનની ફળફુપ્તા અને ઉત્પાદકતા પર ટૂકનોંધ લખો.

- (બ) જમીનમાં રહેલા પોટેશિયમનું પ્રમાણ શોધવાની રીત વિશે ચર્ચા કરો.

**અથવા**

જમીનમાં રહેલા કુલ નાઈટ્રોજન કેવી રીતે શોધી શકાય સમજાવો.

3. નીચે દર્શાવેલ પ્રશ્નોના જવાબ આપો :

- (અ) જમીનમાં રહેલા કુલ મેનેશિયમ શોધવાની વર્સેનેટ (EDTA) પદ્ધતિનું વર્ણન કરો.

**અથવા**

જમીનમાં રહેલા લાઈમ શોધવાની પદ્ધતિની ચર્ચા કરો.

- (બ) જમીનનું બંધારણ માટેની યાંત્રિક પૃથ્વકરણની રીતની ચર્ચા કરો.

**અથવા**

જમીનમાં રહેલ કુલ હાજર સલ્ફર કેવી રીતે શોધી શકાય ?

14

14

14

4. નીચે દર્શાવેલ પ્રશ્નોના જવાબ આપો :

14

(અ) જમીનમાં રહેલા દ્રાવ્ય કાર શોધવાની ચર્ચા કરો.

અથવા

જમીનમાં રહેલા આર્થિક (II & III) શોધવાની પરમાણુ અવશોષણ સ્પેક્ટ્રોમિતી પદ્ધતિની ચર્ચા કરો.

(બ) ખેતીલાયક જમીનમાં રહેલા સિલિકા કેવી રીતે માપી શકાય ?

અથવા

જમીનમાં રહેલ કુલ મેંગેનીઝ શોધવાની પદ્ધતિની ચર્ચા કરો.

5. નીચે દર્શાવેલ પ્રશ્નોના જવાબ આપો :

14

- (1) જમીનની સામાન્ય અને રાસાયણિક રૂચના (કમ્પોઝિશન) લખો.
- (2) જમીનમાં હાજર સૂક્ષ્મ તત્ત્વોના નામ આપો.
- (3) સોઈલ ફોર્મેશન માટે જવાબદાર પરિબળોના નામ આપો.
- (4) જમીનમાં રહેલા મુખ્ય તત્ત્વોના નામ લખો.
- (5) ફ્લેમ ફોટોમીટીનો હેતુ શું છે ?
- (6) જમીનમાં રહેલ લભ્ય ફોસ્ફરસ શોધવા માટે ક્યા દ્રાવણોની જરૂર પડે છે ?
- (7) ફળદુપ જમીનની pH કેટલી હોય છે ?
- (8) જમીનમાં સલ્ફર ક્યા સ્વરૂપમાં હાજર હોય છે ?
- (9) ગૌડા તત્ત્વો શું છે ?
- (10) જમીનમાં હાજર મેનેશિયમ અને કેલિશિયમ શોધવાની રીતોના નામ લખો.
- (11) દ્રાવ્ય કાર વ્યાખ્યાપિત કરો.
- (12) વિદ્યુત વાહકતા વિશે તમે શું જાણો છો ?
- (13)  $25^{\circ}\text{C}$  તાપમાને  $0.01\text{N KCl}$  ના દ્રાવણની વાહકતા કેટલી હોય છે ?
- (14) જમીનમાં રહેલા 'Na' શોધવા માટેની પદ્ધતિના નામ આપો.